

October 29, 2021

**BSE Limited** 25<sup>th</sup> Floor, P J Towers, Dalal Street, Fort, Mumbai- 400 001 Scrip Code: 531637

Dear Sir,

Sub.: Newspaper clipping – Postal Ballot Notice

Please find attached herewith the copy of newspaper notice informing about the Postal Ballot Notice / E-voting as published in the requisite newspaper as per the requirement of Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

Kindly take the same on records and oblige.

Thanking You,

Yours Faithfully,

For Praveg Communications (India) Limited

(Formerly known as Sword and Shield Pharma Limited)

Mukesh Chaudhary Company Secretary &

Compliance Officer

Encl. : As Above

### PRAVEG COMMUNICATIONS (INDIA) LIMITED



## WESTERN RAILWAY TO RUN FESTIVAL SPECIAL TRAINS FROM BANDRA TERMINUS TO AJMER & JODHPUR

Ahmedabad, For the convenience of passengers and with a view to meet the and with a view to meet the travel demand, Western Railway has decided to run Festival Special Trains on Special Fare between Bandra Terminus - Jodhpur.

According to a press release issued by Shri SumitThakur - Chief Public Relations Officer of Western Railway, the details of the special trains are as under:

1)Train No. 09622/09621
Bandra Terminus - Ajmer Special Wild depart from Bandra Terminus on Monday at 05-30 hrs & will depart from Bandra Terminus on Monday at 05-30 hrs & will reach Ajmer at 01.30 hrs, the

on Monday at 05.30 hrs & will reach Ajmer at 01.30 hrs, the next day. This train will run on 8th November, 2021. Smilarly, Train No. 096.21 Ajmer - Bandra Terminus Special will depart from Ajmer on Sunday at 06.35 hrs & will reach Bandra Terminus at 04.15 hrs the next day. This train will run on 7th November, 2021. Enroute this train will halt at Borivali, Vapj. Surat, Vadodara, Ratlam, AbawaniMandi, Kota, 2021.Enroute (ms. uanı xm.)
alla ta Borivali, Vapi, Surat,
Vadodara, Ratlam,
BhawaniMandi, Kota,
SawaiMadhopur, Durgapura,
Jajpur and Kishangarh Sations
in both directions. This train
comprises of AC 2-Tier, AC 3Tier, Sleeper Class and Second
Class Seating coaches.
2) Train No. 04808/04807
Bandra (T) - Jodhpur Festival

Ahmedabad, Toshiba Johnson Elevators (India) Pvt. Ltd. (hereinafter referred to as TJE1), India's fastest growing elevator and scalator company, today announced winning massive orders to supply 168 elevators at three flagship projects of the celebrated RMZ Corp one of Asia's largest privately-owned real estate owners, sinvestors, and developers.

**Toshiba Johnson Elevators to supply 168** elevators at RMZ Corp flagship Projects

Luni stations in both directions. This train comprises of AC 2-Tier, AC 3-Tier, Sleeper Class and Second Class Seating coaches. The booking of Train No. 09622 & 04808 will open

A TERMINUS TO AJMI
Special [2 Trips]
Train No. 04808 Bandra
Terminus - Jodhpur Special
will depart from Bandra
Terminus on Sunday at 14.45
hrs & will reach Jodhpur at
09.45 hrs the next day. This
train will run on 7th November,
2021. Similarly, Train No.
04807 Jodhpur - Bandra
Terminus Special will depart
from Jodhpur on Saturday at
17.15 hrs & will reach Bandra
Terminus Al 11.55 hrs the next
day. This train will run on 6th
November, 2021. Enroute this
train will halt at Borivali, Vapir,
Surat, Vadodara, Ahmedabad,
Mahesana, Patan, Bhildi,
Dhanera, Raniwara,
MarwarBhinmal, Modran,
Jalor, Mokalsar, Samdari and from 30th October, 2021at nominated PRS counters and IRCTC website. Above trains will run as fully reserved will run as fully reserved special trains on special fare. For detailed information regarding timings of halts and composition, passengers may please visit www. enquiry.indianrail.gov.in. Passengers are requested by Western Railway, to adhere to COVID-19 during boarding, travelling and at the destination.

**Defamation case: Rahul Gandhi** to appear in Surat court

Ahmedabad : Congress leader Rahul Gandhi is likely to to record his statement in the court of chief judicial magistrate at Surat District and Sessions Court on October 29. Statements of two more witnesses were recorded in the defamation case against him, Gandhi had last appeared in court in June and denied making any defamatory comments against Modi surname. "Rahul Gandhi is likely to remain present in the court to record his statement after the court examined two more witnesses," said Kirit Panwala, Gandhi's lawyer. Earlier, complainant in the defamation case, Surat West BJP MLA and currently state the defamation case against

cabinet minister Purnesh Modi, had requested the local court to record statements of two additional witnesses, which the court rejected. Later, Modi approached the High Court which directed the local court to reconsider its order. "Later an officer and a video grapher's statements were recorded by the court. They were part of the surveillance team of Election Commission," said Panwala. The case of April 2019 was filed under Indian Penal Code sections 499 and 500 after Gandhi had made a comment on the community in a political

on the community in a political rally at Kolar in Karnataka on April 13, 2019 in the run up to general elections.

## PUBLIC NOTICE

Registered office: ICICI Bank Bandra (East), Mumbai- 40005

Corporate Office: ICICI HFC Town, JB Nagar, Andheri Kurfa Road, Andheri East, Mumbai- 400059 Corporate Office: ICICI HFC Town, JB Nagar, Andheri Kurfa Road, Andheri East, Mumbai- 400059 Waghawadi Road, Bharmagar – 384002. The following bornovers have defaulted in the repayment of principal and interest of the loans facility of them from ICICI Home Finance Company Limited ("ICICI HFC") and the loans have been classified Performing Assets (FPA). Anotice was sissued to them under Section 13 (20) Securitisation and Re-cons Financial Assets and Enforcement of Security Interest Act-2002 on their last known addresses, however served and hence they are hereby notified by way of the public notice.

Sr. No.	Name of the Borrower/ Co-Borrower/ Guarantor/ (Loan Account Number) & Address	Property Address of Secured Asset / Asset to be Enforced	Date of Notice Sent/ Outstanding as on Date of Notice	NPA Date
1.	Sajeevan K Karunakaran (Borrower), Rashmi M Sanjeevan (Co- Borrower), SO Karunakaran, Indra Pasath Society Jafrabad Road, At Rajula Amreli 365560 / NHRJL 00001264585.	Shubhamnagar Jafarabad Road Plot No 12 Rajula- 364560	27-08-2021 Rs. 2,29,241/-	05/04/ 2021

Date : October 29, 2021 Place: Bhavnagar

# Two woman cops on indefinite fast



AHMEDABAD: After the state government said that police personnel have been getting remuneration according to the Seventh Pay C o m m i s s i o p according to the Seventh Pay
C o m m is s i o n
recommendations, cops from
across the state have decided
to take their agitation to the
next level. Minister of state for
home Harsh Sanghavi met
representatives of the

RMZ Corp's joint venture with Mitsui Fudosan (Asia) Pte. Ltd., a subsidiary of Mitsui Fudosan Co., Ltd. a global real

rudosan Co., Ltd. a global real estate developer headquartered in Tokyo.

Thrilled over this new association, Mr. Katsuhiko Sato, Managing Director, TJEI said, "We are happy that our work over the last 10 years have utilized apparetable.

has cultivated remarkab trust for Toshiba. I would lik

### Division traffic police announced Gandhinagar, Pandva was on agitating cops and promised

them that a committee will be formed to look into the issues concerning the agitation. The agitation intensified more with two women cops, one from Navrangpura police station in Navrangpura police station in the city and another from L at the state secretariat in

that they would sit on an indefinite fast to press their



REGD. OFFICE: 403, Mauryansh Elarza, Nr. Parish Hospital, Shyamal Cross Road, Satellite, Ahmedabad - 38

1. (1079) (2076 8572, 2376 8575 Fax: + 91 - 72 - 2576 857, CNR 667 202, 19549/LC02303, E-Mail: kskpaj@yahoo. n. Web Sile: w
EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR EN
SEPTEMBER 30, 2021

41		QUARTER ENDED			HALF YEAR ENDED		
PARTICULARS	30/09/2021	30/06/2021	30/09/2020	30/09/2021	30/09/2020	31/03/2021	
	(Unsudited)	(Unsudited)	(Unaudited)	(Unsudited)	(Unaudited)	(Audited)	
MONTH COVERED	3	3	3	6	6	12	
Total Income From Operating Income	10.05	9.88	11.06	19.93	35.83	48.25	
Net Profit/(Loss) for the Period (Before Tax and Exceptional Item)	4.03	(0.35)	7.30	3.68	15.33	18.22	
Net Profit/(Loss) for the Period (Before Tax and After Exceptional Item)	4.03	(0.35)	7.30	3.68	15.33	18.22	
Net Profit/(Loss) for the Period After Tax	3.11	(0.35)	5.48	2.76	11.50	15.28	
Total Comprehensive Income For the Period (Comprehensive Profit/(Loss) for the period lafter Tax) and Other Comprehensive		(0.35)	5.48	2.76	11.50	15.28	
Income (After Tax)		,					
Paid up Equity Share Capital (Face value Rs. 10/- Per Shares)	315.84	315.84	315.84	315.84	315.84	315.84	
Basic Earning Per Share (EPS) in Rupees after Exceptional Item	0.10	(0.01)	0.17	0.09	0.36	0.48	
Diluted Earning Per Share (EPS) in Rupees after Exceptional Item	0.10	(0.01)	0.17	0.09	0.36	0.48	

		QUARTER ENDED			HALF YEAR ENDED		
PARTICULARS	30/09/2021	30/06/2021	30/09/2020	30/09/2021	30/09/2020	31/03/2021	
	(Unsudited)	(Unsudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)	
MONTH COVERED	3	3	3	6	- 6	12	
Total Income From Operating Income	10.05	9.88	11.06	19.93	35.83	48.25	
Net Profit/(Loss) for the Period (Before Tax and Exceptional Item)	4.03	(0.35)	7.30	3.68		18.22	
Share of Profit / (Loss) of an Associate						0.36	
Net Profit/(Loss) for the Period (Before Tax and After Exceptional Item)	4.03	(0.35)	7.30	3.68		18.58	
Net Profit/(Loss) for the Period After Tax	3.11	(0.35)	5.48	2.76	11.50	15.54	
Total Comprehensive Income For the Period (Comprehensive							
Profit/(Loss) for the period (after Tax) and Other Comprehensive	3.11	(0.35)	5.48	2.76	11.50	15.54	
Income (After Tax)							
Paid up Equity Share Capital (Face value Rs. 10/- Per Shares)	315.84	315.84	315.84	315.84	315.84	315.84	
Basic Earning Per Share (EPS) in Rupees after Exceptional Item	0.10	(0.01)	0.17	0.09	0.36	0.49	
Diluted Earning Per Share (EPS) in Rupees after Exceptional Item	0.10	(0.01)	0.17	0.09	0.36	0.49	

#### owned real estate owners, investors, and developers. TJEI will install, maintain, and operate 70 elevators at RMZ Ecoworld 30 in Bengaluru, 63 elevators at Nexity in Hyderabad and 35 elevators at Nexity in Hyderabad and 35 elevators at Nexity in Hyderabad and 35 elevators at Nexity in Hyderabad MMZ Exity in Hyderabad MMZ Nexity in Hyderabad trust for IoSniba. I would like to express my deep gratitude to Mitsui Fudosan and RMZ Corp for choosing us for their maiden joint project in India. We feel privileged to work with the companies that share Hyderabad and 35 elevators at RMZ Spire in Hyderabad. RMZ our persistence for quality and excellence. (19-10) Ecoworld 30 is the first development undertaken in PRAVEG **Londonyard Pizza celebrated**



Ahmedabad, When the pizza was first invented it was considered art to make because they were all made entirely by hand. They did not have the help of machines or automatic baking devices, from start to finish they were hand-made. Londonyard Pizza has 80 outlets in Gujarat. It's Artisan Pizza. The term "artisan" is generally used to define someone who has extensive knowledge and training of a certain craft. When the word is applied to food, it means it is prepared using traditional methods instead of machines and with the highest-quality ingredients. Speaking about the highest-quality ingredients. Speaking about the first anniversary, Anand

Hina Thakkar, founder of Londonyard Pizza, said "We have received a very good response from the Gujarat market in this one year which motivates us to do better. The brand believes in not just selling food but giving a wholesome experience for the ambiance, customer service, food quality, pricing, and hygiene all at once." Talking about the expansion plan of the company he shared that "Company has strategically planned the expansion for the coming 5 years and has planned to open 250 – 300 stores Pan India, Also Company has planned to pen 250. Company has planned to pen 250. Company has planned to pen 250. Sompany has planned to pen 250. Sompany has planned to pen 250. Sompany has planned to 2022. (13-9)

### PRAVEG COMMUNICATIONS (INDIA) LIMITED

Registered Office: 214, Athena Avenue, Behind Jaguar Showroom, S.G. Highway, Gota, Ahmedabad-382481 | Phone: 91 79 27496737 |
Website: www.praveg.com | Email: cs@praveg.com

MOTICE FOR THE ATTENTION OF MEMBERS OF THE COMPANY

Members of the company are hereby informed that a Postal Ballot Notice, seeking members' consent on the
resolutions set out in the said notice has been sent electronically to the members whose e-mail address is
registered with the company / McCS Share Transfer Agent I, Imited, Company's Registrar and Transfer Agent,
Pepository Participant(s), as on Friday, October 22, 2021, i.e. the Cut-Off Date. The company has complete
electronic dispation of the Postal Ballot Notice on Transday, October 28, 2021.

The Notice of the Postal Ballot Notice on Transday, October 28, 2021.

The Notice of the Postal Ballot Notice on Transday, October 28, 2021.

The Notice of National Securities Depositor,
from the above-mentioned website.

The documents referred to in the Postal Ballot Notice are available for inspection electronically and members
eleking to inspect such documents can send an e-mail to sciepraveg.com.

ing to inspect such documents can send an e-mail to Losepharosquam.

Tractions for e-voting-lic circulars issued by Ministry of Corporate Affairs, the Company is providing embers the facility to execte their right to vote on the resolutions proposed in the said Postal Ballot Not by electronic means ("e-voting"). The communication of the assent or dissent of the members would tell by electronic means ("e-voting"). The communication of the assent or dissent of the members would tell through remote e-voting process only. The company has engaged the services of NSDL as the agency dee e-voting facility. Members may cast their votes during the period mentioned herein below:

mencement of e-voting : 9:00 A.M. (IST) Friday, October 29, 2021 of e-voting of e-voting (ST) Sturday, November 27, 2021

A person, whose names is recorded in the Register of Members / List of Beneficial Owners as on the Cut-Off Date shall only be considered eligible for the purpose of e-voting. Voting rights on smember / beneficial owner (in case of electronic shareholding) shall be in proportion to his/her/is shareholding in the paid-up equity share capital of the company as on the Cut-Off Date. A person who becomes a member / there her Cut-Off Date should treat this notice for information purpose only. Manner of registering / updating e-mail address:

I. Members who hold the shares in physical mode and have not registered / updated their e-mail address with the company, can register / update the same by giving details of Folio No, e-mail address, PAN (self Lembers who foling shares in dematerialised mode and have not registered / updated their e-mail address, can register / update their e-mail address with the Depository Participant(s) where they maintain their demat accounts.

accounts.

he resolutions, if approved, shall be deemed to have been passed on the last date of e-voting i.e. Saturday, ovember 27, 2021. The results of e-voting will be announced by Monday, November 29, 2021, and will be approved on the Company evidence with the property of the Company will also display the results of the Postal Ballot at its Registered Office.

To case of any query relating to remote e-voting you may refer the FAQs for Shareholders and e-voting user sanual for Shareholders available at the download section of www.evoting.nsdl.com or call on toll free no. 3001020990 and 1800224430 or send a request at evoting@isscl.com. So Video ref. Board of Benefit Persection.

By Order of Bord of Derecto

Mukesh Cha

## **Shantai Industries Limited**

(fromerly known as Wheel and Alde Textiles Limited)
Reg.Office: 820, Golden Point, Nr. Telephone Exchange, Begumpune, Falsawadi,
Ring Road, Suart - 395003. Phi: 0261 - 2455425 - 2455426
Branch/Godown: 435, Sawlani Slik Mills Compound, G.I.D.C, Pandesara, Surat (India)
Phone: 0261 - 2891991 to 994 - Fax: 0261 - 2891901919994
Fax: 0261 - 289190119994 - Fax: 0261 - 2891901998PLC013255
of Standalone Audited Financial Results for the Outstre/Half Year ended Sectember 30. 2021

			(Rs. in Lacs)
Particulars	Quarter Ended 30-September- 2021	Year to date figures for the period ended 30-September- 2021	Quarter Ended 30-September- 20
Total income from operations (net)	0	0	2.50
Net Profit / (Loss) from ordinary activities after tax	(3.36)	(9.48)	(32.34)
Net Profit / (Loss) for the period after tax (after Extraordinary items)	(3.36)	(9.48)	(32.34)
Equity Share Capital	150.00	150.00	150.00
Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of previous year)	599.59	599.59	599.59
Earnings Per Share (before extraordinary items) (of Rs. 10/-each) Basic : Diluted:	(0.22) (0.22)	(0.63) (0.63)	(2.16) (2.16)
Earnings Per Share (after extraordinary items) (of Rs. 10/- each) Basic : Diluted:	(0.22) (0.22)	(0.63) (0.63)	(2.16) (2.16)

he above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed with the Sto Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulation 2015. The full format of the Quarterly/Annual Financial Results are available on the Stock Exchange

ai Industries Limited sd/-Vasudev F. Sawlani (MD)

#### NANDINI TEXCOM (INDIA) LIMITED CIN: L65910GJ1994PLC021165

ational Commerce Center, Near Kadiwala Scho

Tel:0261-4004596 Email: nandinitexcom@hotmail.com, website: nandinitex.com

STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30TH SEPTEMBER, 2021-

			•		(Rs. in Lacs)	
		QUARTER ENDE		Half Yea		Year ended
PARTICULARS	30-09-2021	30-06-2021	30-09-2020	30-09-2021	30-09-2020	31-03-2021
	(Un-Audited)	(Un-Audited)	(Un-Audited)	(Un-Audited)	(Un-Audited)	(Audited)
PART I						
1. Net Income from Operation	1,699.44	615.19	745.50	2,314.63	745.50	3,451.32
2. Expenditure						
a. Consumption of Raw Material				-		
b. Purchase of Stock-in-Trade	1,040.00	1,101.08	892.64	2,141.08	892.64	3,663.91
c. Change in Inventories of Finished						
Goods & Work-in-progress	470.25	(536.83)	(167.54)	(66.58)	(167.54)	(367.88)
d. Employees Benefits Expenses	5.65	5.46	10.82	11.11	10.83	22.36
e. Depreciation						5.79
f. Other Expenses	29.65	24.63	27.51	54.28	27.49	93.59
g. Total Expenditure	1,545.55	594.34	763.43	2,139.89	763.42	3,417.77
3. Profit from Operations before Other						
Income. Interest & Exceptional Items(1-2)	153.89	20.85	(17.93)	174.74	(17.92)	33.55
4. Other Income	(0.13)	0.15	5.90	0.03	5.93	8,17
5. Profit before Interest and Exceptional	()					
Items (3+4)	153.77	21.00	(12.03)	174.77	(11.99)	41.72
6. Financial Cost	13.75	15.33	23.52	29.08	23.52	41.64
7. Profit after Interest but before	2017-0					
Exceptional Items (5-6)	140.02	5.67	(35.55)	145.69	(35.51)	0.08
8. Exceptional Item	110102	0.07	(00,00)	*1000	(00102)	
9. Profit/(Loss) from Ordinary Activities						
before Tax (7+8)	140.02	5.67	(35.55)	145.69	(35.51)	0.08
10. Taxation Expenses			()		(00102)	
a. Current Tax						0.06
b. Deferred Tax Liability/(Assets)						0.04
c. Total Tax Expenses						0.10
11. Net Profit/(Loss) from Ordinary						
activities after tax (9-10)	140.02	5,67	(35.55)	145.69	(35.51)	(0.02)
12. Extraordinary Items			(00100)		(00102)	()
13. Net Profit/(Loss) for the period (11-12)	140.02	5.67	(35.55)	145.69	(35.51)	(0.02)
14. Paid up Equity Share capital	50.00	50.00	50.00	50.00	50.00	50.00
(Face value of Rs. 1/- each per share)						
15. Reserve excluding Revaluation Reserver as						
per previous Balance Sheet						
16. Earning Per Share						
Before Extraordinary Items						
a. Basic & Diluated EPS	2.80	0.11	(0.71)	2.91	(0.71)	(0.00)
After Extraordinary Items	2100	0111	(01) 2)		(01.7)	(0.00)
a, Basic & Diluted EPS	2.80	0.11	(0.71)	2.91	(0.71)	(0,00)

Statement of Assets and Liabilities		Unaudited		
Particulars	Six Months Ended	Six Months Ended		
	30-09-21	30-09-20	31-03-21	
I. EQUITY AND LIABILITIES				
(1) Shareholder's Funds				
(a) Share Capital	500.01	500.01	500.01	
(b) Reserves and Surplus	354.86	173.66	209.17	
(2) Non-Current Liabilities				
(a) Long-term borrowings	277.57	48.02	5.00	
(b) Deferred tax liabilities (Net)				
(c) Other Long Term Liabilities				
(d) Long term provisions				
(3) Current Liabilities				
(a) Short-Term borrowings	710.27	384.08	932.13	
(a) Trade payables	143.51	87.63	66.88	
(b) Other current liabilities	76.06	54.75	3.77	
(c) Short-term provisions				
	otal 2,062.28	1,248.15	1,716.97	
II.Assets				
(1) Non-current assets				
(a) Fixed Assets	31.97	36.66	31.55	
(b) Non-current investments				
(c) Deferred Tax Assets (Net)	1.20	1.24	1.20	
(d) Long term loans and advances	0.87	71.83	2.02	
(e) Other non-current assets	-			
(2) Current assets				
(a) Current investments				
(b) Inventories	695.62	428.70	555.88	
(c) Trade receivables	716.61	445.60	629.04	
(d) Cash and cash equivalents	0.21	0.87	0.20	
(e) Short-term loans and advances	615.79	263.25	497.07	
т	otal 2,062.28	1,248.15	1,716.97	

NOTES

1. The above unaudited results have been reviewed by the Audit Committee and taken on record by the Board of Directors at their meeting held on 27th October, 2021.

2. The company is not carrying any segment in its business activities therefore no segment reporting has been done.

3. Previous Period's/Year's figures have been regrouped /recast wherever necessary to make them comparable with those of the current period.

For, Nandini Texcom (India) Limit

Place : **Surat** Date : **27.10.2021** 

## સુરતમાં વેપારીને ૨૪ વર્ષની યુવતીએ ફસાવી લાખો રૂપિયા પડાવ્યા બાદમાં ફરિયાદ કરી

સુરત, સુરત જિલ્લામાં રહેતી મહિલાની ફરિયાદ લેવાની શરૂઆત ૨૪ વર્ષીય યુવતીએ પ૦ વર્ષીય કરી હતી પછી મહિલાએ બારોબાર વેપારીને પોતાની માયાજાળમાં વેપારી સાથે સમાધાન કરી લીધું હતું. વપારામ પાતામાં માયાજીળમાં ફસાવ્યો હતો. યુવતી વેપારી સાથે ડુમસના એક ફાર્મમાં ગઈ હતી. હવે યુવતીએ વેપારી પર એવો આરોપ લગાડયો કે કાર્મહાઉસમાં વેપારીએ તેના પર બળાત્કાર કર્યો હતો. આવા ગંભીર આરોપ લગાડી યુવતી ડુમસ પોલીસ સ્ટેશનમાં કરિયાદ કરવા માટે થોડા દિવસો પહેલા આવી પહોંચી હતી.વેપારી આલમ અને પોલીસ બેડામાં ભારે ચર્ચાઈ રહી છે. જો કે આ સ્વરૂપ વાન યુવતીના પ્રેમમાં વેપારી કેવી રીતે પડ્યા અને ફસાયા બાદ તેમાંથી બહાર નીકળવા માટે તગડી રકમ ચૂકવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ મોજીલા વેપારી અને રંગીન મિઝાજની યુવતીની ઓળખ માર્કેટમાં થતા હેવાર ટાંણે આ હોટ ટોપિક ચર્ચાનો વિષય બન્યો છે. આ હનીટ્રેપ હોવાની પોલીસને શંકા છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, મહિલા પોલીસ સ્ટેશને આવી હતી. મહિલાએ વેપારી સામે બળાત્કારનો આરોપ લગાડયો હતો.

પોલીસે ફરિયાદ આપવાની વાત કરી તો મહિલાએ હવે મારે કંઈ નથી કરવું, એવું પોલીસને કહી દીધું હતું. ટૂંકમાં વેપારી હનીદ્રેપનો શિકાર બન્યો હોવાની આશંકા છે. ડુમસના ફાર્મ હાઉસમાં એક યુવતીએ શહેરના મોટા ગજાના વેપારીની સામે બળાત્કારનો ગંભીર આરોપ લગાડી બાદમાં સમાધાન કરી લીધું હોવાની વાત સામે આવી રહી છે. જો કે આ ઘટનામાં વેપારી હનીટ્રેપનો શિકાર બન્યો હોવાની વાત પોલીસ બેડામાં ચર્ચાઈ રહી છે. જે મહિલા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ કરવા આવી તે યુવતીએ લાખોની ૨કમ વેપારી પાસેથી પડાવી હોવાની વાત સામે આવી રહી છે. જેના કારણે સમાધાન થયું હોવાની વાત સામે આવી રહી છે. ખરેખર આ કેસમાં પોલીસ કમિશનર ઉડાણપૂર્વક તપાસ કરાવે તો હનીટ્રેપને મામલો સામે આવી શકે છે. પોલીસે યુવતીની ફરિયાદ લેવાની તજવીજ શરૂ કરી એટલામાં જ યુવતી અચાનક બહાર નીકળી ગઈ હતી.

## શ્રી વી સતીશ કુમારે ઇન્ડિયન ઓઇલના ડિરેક્ટર (માર્કેટિંગ) તરીકેની જવાબદારી સંભાળી



અમદાવાદઃ શ્રી વી સતીશ કુમાર (પદ્દ)એ ભારતના સૌથી મોટા . વ્યાપારી સાહસમાંની એક અને ફોર્ચ્યુન ગ્લોબલ ૫૦૦ લિસ્ટિંગમાં અગ્રણી ભારતીય કંપનીમાંની એક ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના ડાયરેક્ટર (માર્કેટિંગ)

તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. ડાયરેક્ટર (માર્કેટિંગ) તરીકેની તેમની પદોશ્વતિ અગાઉ શ્રી કુમાર મધ્યપ્રદેશ અને છત્તીસગઢના બિઝનેસ હેડ હતા, જે રિટેલ અને સીધા વેચાણ, એલપીજી, લ્યુબ વેચાણ, કામગીરી, લિમિટેડના બોર્ડમાં પણ છે.(૨૨-૧)

પ્રોજેક્ટ મેનેજમેન્ટ, પ્લાનિંગ, એચઆરડી અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીની દેખરેખ રાખતા હતા એલપીજી કન્ઝ્યુમર તેમણે એલપીજી કન્ઝ્યુમર (ડીબીટીએલ), પ્રધાનમંત્રી ઉજ્લ્વલા યોજના (પીએમયુવાય) માટે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર અને બીએસ-દ ઈંધણમાં શિક્ટ જેવી મખ્ય વ્યવસાયિક પહેલનો અમલ કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે. દેશના વિવિધ પ્રદેશોમાં પેટ્રોલિયમ ઉત્પાદનોના માર્કેટિંગની ત્રણ દાયકાથી વધુની તેમની કુશળતા સાથે તેઓ બોર્ડમાં કાર્ય કરશે. શ્રી સતીશ કુમાર વર્તમાનમાં બાંગ્લાદેશમાં પેટોલિયમ ઉત્પાદનોની આયાત અને માટે માળખાગત સુવિધાઓ સ્થાપવા માટે રચાયેલી આઇઓસી મિડલ ઇસ્ટ નાટ સ્થાપલા આઇઆસા ાનડલ ઇસ્ટ એફ્ઝેડઇ (દુબઈમાં ઇન્ડિયન ઓઇલની સંપૂર્ણ માલિકીની પેટાકંપની) અને બેક્સિમ્કો,

# ભાજપના સભ્યોનું સેનેટ ચૂંટણી લડવા કોંગ્રેસ સાથે સેટિંગ

રાજકોટ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલ ૨૦૩ સેનેટ સભ્યો છે. જેમાં ૪૩ સીટ પર આગામી સમયમાં ચૂંટણી થઇ શકે તેમ છે. જેમાં હાલ ટીચર્સની બેઠકમાં આર્ટસમાં પ્રવિશસિંહ ચૌહાણ, જેઠા ચંદ્રાવાડીયા, ક્રિપાલસિંહ પરમાર ચંદ્રાવાડાયા, ાકપાલાસહ પરમાર, રાજદીપસિંહ જાડેજા, સાયન્સમાં મેહુલ રૂપાશી, નિકેશ શાહ, અર્જુન પટેલ, કાયદામાં રાજ દવે, એચ.એન.ગલાશી, મેડિકલમા વિજય પોપટ, કમલ ડોડીયા, ઉમેદ પટેલ, કોમર્સમાં સ્નેહલ કોટક અને એક સીટ ાલી પડી છે, એજ્યુકેશનમાં તૌસીફ પઠાણ, રૂરલ સ્ટડીઝમાં એન. એચ.જાટકીયા, નિલેશ મારસોનીયા, હોમસાયન્સમાં સીટ ખાલી, હોમિયોપેથીમાં સમીર કાનાણી, આર્કિટેક્ચરમાં હિતેશ ચાંગેલા. આાક્ટક્ચરમાં હાતશ ચાગલા, બીઝનેસ મેનેજમેન્ટમાં જયદીપસિંહ ડોડીયા હતા. જોકે તેઓ હાલ ભાવનગર યુનિવર્સિટીમાં ડેપ્યુટી રજીસ્ટ્રાર છે. ફાર્મસીમાં મિહિર રાવલ જે હાલ વડોદરા યુનિવર્સિટીમાં હતા હતા હતા હતા હતા. છે. પર્ફોર્મિંગ આર્ટસમાં ભારતીબેન રાહોડ રિટાયર્ડ થતાં તેમની સીટ પણ ખાલી છે. રજિસ્ટર્ડ ગ્રેજયુએટની સીટમાં આર્ટસમાં રાજભા જાડેજા, સાયન્સમાં રશ્મીન પટેલ. કાયદામાં કપિલ શુક્લા, મેડિકલમાં ભરત કાકડિયા, કોમર્સમાં ભરતસિંહ જાડેજા, એજ્યુકેશનમાં મનોજ ભટ્ટ, રૂરલ સ્ટડીઝમાં દીપુ પરમાર, હોમસાયન્સમાં મમતા પુરોહિત, હોમ્યોપેથીમાં ભરત વેકરિયા, હાામ્યાપથામાં ભરત વકારયા, આર્કિટેક્ચરમાં રાહુલ મહેતા, મેનેજમેન્ટમાં ગત ટર્મમાં મિતેશ અમૃતિયા, જોકે તેમનું કોરોનાના લીધે નિધન થતા સીટ ખાલી પડી છે. પરફૉર્મિંગ આર્ટસમાં વિવેક હીરાણી, આવી ચક્ર્યા હોય તેવા એક પણ સભ્યો સેનેટ સહિય યુનિવર્સિટીની કોઈ ચૂંટણી નહી લડી શકે.

ફાર્મસીમાં વિશ્વાસ રાણપરીયા, માધ્યમિક સ્કૂલમાં ટીચરની ર સીટમાં કોંગ્રેસના લીલા કડછા. તાંટના કાંગ્રસના લાલા કડછા, પ્રિયવદન કોરાટ અને પ્રિન્સીપાલની ૨ સીટમાંના એક હબીબ માથકીયા **%यारे अन्य अनिरुद्धसिंह प**ढियार ભાજપના છેસૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત અધ્યાપકોની ભરતી પ્રકરણમાં ભલામણના વિવાદે વધુ એક વળાંક લીધો છે. ગાંધીનગરથી હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને 'ગુનેગારમુક્ત' કરવાનું ફરમાન છૂટ્યું છે. રાજ્યની તમામ યુનિવર્સિટીઓના વડા રાજ્યપાલે સ્ટેચ્યુટ ૧૮૭ પણ મંજર કરી દીધો છે. આ મુજબ ગુનેગારો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક પણ ચૂંટણી નહિ લડી શકે. જો કે, કોંગ્રેસની સાથે ખુદ ભાજપના જ સિન્ડિકેટ સભ્યો ગાંધી-વૈદ્યનું સહિયારું કરીને આ પ્રયાસને ઊથલાવવા અંદરખાને ભેગા થયાની ચર્ચાથી ફરી વિવાદ થયો છે. હવે અ સ્ટેચ્યુટ ૧૮૭નો અમલ આગામી સેનેટ ઈલેક્શનમાં ન થાય તે માટે ભાજપ-કોંગ્રેસના સભ્યો ધમપછાડા કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગત તારીખ ૧૪.૦૮.૨૦૧૯ના ઠરાવ ક્રમાં ક ૬૦ અને તારીખ ૦૭.૧૨.૨૦૧૯ની સેનેટના ઠરાવ ૦૭.૧૨.૨૦૧૯ના સનટના સ્વા કમાંક ૯ મુજબ ભાજપના સભ્ય ડો.મેહુલ રૂપાણીના પ્રસ્તાવથી સ્ટેચ્યુટ ૧૮૭ મંજૂર થયો હતો, જે રાજ્યપાલની મંજૂરીથી કાયદો પણ બનીગયો છે. આ સ્ટેચ્યુટ ૧૮૭ મુજબ ટાડા, પાસા, દ્વકેંજી, આર્મ્સ એક્ટ, મની લેન્ડરિંગ, પરીક્ષામાં કોપી કેસમાં કે ડમી વિદ્યાર્થી બેસાડવાના ગુનામાં

# સુરતમાં ઇ-વ્હિકલ ખરીદનારને વાહન વેરો નહીં ભરવો પડે

સુરત, હાલમાં પાલિકા ચાજિંગ સ્ટેશન માટે ૨૦૦ સ્થળ શોધી રહી છે. ચાર્જિંગ સ્ટેશનોના ડિજિટલ ડેટા બેઝ તૈયાર કરાશે. જેનાથી લોકેશન અને કેટલું વેઇટિંગ ચાલી રહ્યું છે તેવી માહિતી ચાલકોને વેબ તથા એન્ડ્રોઇડ એપ્લિકેશનથી જ મળી રહેશે. પોલિસીના ભાગરૂપે પાલિકાના ૧૬ હજાર કર્મીઓને ઇ-વ્હિકલ ખરીદવા લોન આપી શકે છે. આ માટે SMC એમ્પ્લોઇ ક્રેડિટ સોસાયટી સાથે સંકલન સાધી જરૂરી વ્યવસ્થા કરશે પાલિકા ઇ-પિંક ઓટો પ્રોજેક્ટ અંતર્ગત લાભાર્થીઓને પહજાર પ્રતિ ઓટો નાણાકીય સહાય પણ આપશે જે કેન્દ્ર-રાજ્ય સરકાર તરફથી મળનારી સહાય ઉપરાંતની હશે. ગુરુવારની સ્થાયીમાં પોલિસીની મંજરી માટે ચર્ચા કરાશે, જેમાં અમલ, મીડ ટર્મ રિવ્યૂ, ટેક્નોલોજિકલ સુધારા માટે મેને જિંગ કમિટી તથા ઇમ્પિલમેન્ટિંગ કમિટીની રચના પણ કરાશે. પાલિકાએ ઇ-વ્હિકલ પોલિસીના ભાગરૂપે પાલિકા પ૭૫

ટેમ્પોને પણ ઇ-વ્હિકલમાં ફેરવાશે.શહેરને પ્રદુષણ મુક્ત પરિવહનના ઉદ્દેશ સાથે પાલિકા સરત સિટી ઇલેક્ટ્રિક વ્હીકલ (ઇવી) પોલીસી ૨૦૨૧નો અમલ કરવા જઇ રહી છે. શહેરને દેશનું પ્રથમ ઇ.વી સ્માર્ટ સિટી બનાવવાના વિઝન સાથે પોલિસી તૈયાર કરાઈ છે. જેની અમલવારી ૩૦ જૂન, ૨૦૨૫

અમલવારા ૩૦ જૂન, ૨૦૨૫ સુધીની રહેશે. પોલિસી અંતર્ગત રાજ્ય ઇલેક્ટ્રિક વ્હિકલ પોલિસીમાં નિર્ધારિત કરેલા ઇલેક્ટ્રિક વાહનોના લક્ષ્યાંક પૈકી ૨૦૮કા વાહનો શહેરની પરિવહન સેવામાં સામેલ કરાશે. જૂન, ૨૦૨૫ સુધીમાં રાજ્યમાં કુલ ૨ લાખ ઇલેક્ટ્રિક વ્હીકલના લક્ષ્યાંક સામે શહેરમાં ૪૦ હજાર વ્હીકલ પરિવહન સેવામાં સામેલ કરાશે વ્હીકલ ટેક્સમાં માફીની જોગવાઇ છે. પ્રથમ વર્ષે ઇ-વાહન ખરીદનારને ઇન્સ્લામારુળ કાયતમાં સ્વતા પત્ર પ્રથમ પત્ર ઇન્યાહાય માટાગારા કરાશે. પાલિકાએ ઇન્સિકલ વ્હીકલ દેશમાંથી ૧૦૦ ટકા મુક્તિ, પોલિસીના ભાગરૂપે પાલિકા પછપ બીજા વર્ષે ૭૫ ટકા, ત્રીજા વર્ષે ૫૦ સિટી બસ, ૧૬૬ બીઆરટીએસ પણ ટકા તથા ચોથા વર્ષથી પોલિસીના

આ ઉપરાંત પ્રથમ ૩ વર્ષ માટે એ ત્વાયરમેન્ટ ઇમ્યુવમેન્ટ ચાર્જમાંથી મુક્તિ અપાશે. ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થતાં શહેરમાં દ મહિનામાં જ પપ૦ ઇ-બાઇક અને ૧૬૪ ઇ-કારનું ૨જિસ્ટ્રેશન થયું છે. એક સરવે મુજબ જુન-૨૦૨૫ સુધીમાં સરકાર નવા ર લાખ ઇ-વાહનો ખરીદશે, જેમાં સુરતમાં ૪૦ હજાર ઇલેક્ટ્રિક વ્હિક્લ્સને પરિવહન સેવામાં સામેલ કરાશે. સ્માર્ટ સિટી મિશન અંતર્ગત સુરત કુલ ૬૦ સોલાર સિટીની યાદીમાં સામેલ છે. હવે ઇલેક્ટિક વ્હિકલ પોલિસીના પ્રથમ ૪૦ હજાર વાહનોના લક્ષ્યાંકને હાંસલ કરીને ઇલેક્ટિક વ્હિકલ સ્માર્ટ સિટીની ખ્યાતિ પણ પામે તેની તૈયારી શરૂ કરવામાં આવી છે.ક્લાય ઓવરોની નીચે ચાર્જિંગ પોઇંટ બનાવાશે. વાહનને ચાર્જ થતાં ૧-૨ કલાક લાગતા હોવાથી સાથે ગેમ ઝોન પણ બનાવાશે. શહેરમાં ૫ વર્ષમાં ૫૦૦ પોઇન્ટ બનાવાશે

KRIOHNA CAPITAL & SECURITIES LTD.

	QUARTER ENDED			HALF YEA	YEAR ENDED	
PARTICULARS	30/09/2021	30/06/2021	30/09/2020	30/09/2021	30/09/2020	31/03/2021
	(Unsudited)	(Unsudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)
MONTH COVERED	3	3	3	6	- 6	12
Total Income From Operating Income	10.05	9,88	11.06	19.93	35.83	48.25
Net Profit/(Loss) for the Period (Before Tax and Exceptional Item)	4.03	(0.35)	7.30	3.68	15.33	18.22
Net Profit/(Loss) for the Period (Before Tax and After Exceptional Item)	4.03	(0.35)	7.30	3.68	15.33	18.22
Net Profit/(Loss) for the Period After Tax	3.11	(0.35)	5.48	2.76	11.50	15.28
Total Comprehensive Income For the Period (Comprehensive Profit/(Loss) for the period (after Text) and Other Comprehensive		(0.35)	5.48	2.76	11.50	15.28
Income (After Tax)						
Paid up Equity Share Capital (Face value Rs. 10/- Per Shares)	315.84	315.84	315.84	315.84	315.84	315.84
Basic Earning Per Share (EPS) in Rupees after Exceptional Item	0.10	(0.01)	0.17	0.09	0.36	0.48
Diluted Earning Per Share (EPS) in Rupees after Exceptional Item	0.10	(0.01)	0.17	0.09	0.36	0.48

		QUARTER ENDED			HALF YEAR ENDED		
PARTICULARS	30/09/2021	30/06/2021	30/09/2020	30/09/2021	30/09/2020	31/03/2021	
	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unmudited)	(Unaudited)	(Audited)	
MONTH COVERED	3	3	3	6	6	12	
Total Income From Operating Income	10.05	9.88	11.06	19.93	35.83	48.25	
Net Profit/(Loss) for the Period (Before Tax and Exceptional Item)	4.03	(0.35)	7.30	3.68	15.33	18.22	
Share of Profit / (Loss) of an Associate	-	-	-	-		0.36	
Net Profit/(Loss) for the Period (Before Tax and After Exceptional Item)	4.03	(0.35)	7.30	3.68	15.33	18.58	
Net Profit/(Loss) for the Period After Tax	3.11	(0.35)	5.48	2.76	11.50	15.54	
Total Comprehensive Income For the Period (Comprehensive							
Profit/(Loss) for the period (after Tax) and Other Comprehensive	3.11	(0.35)	5.48	2.76	11.50	15.54	
Income (After Tax)							
Paid up Equity Share Capital (Face value Rs. 10/- Per Shares)	315.84	315.84	315.84	315.84	315.84	315.84	
Basic Earning Per Share (EPS) in Rupees after Exceptional Item	0.10	(0.01)	0.17	0.09	0.36	0.49	
Diluted Earning Per Share (EPS) in Rupees after Exceptional Item	0.10	(0.01)	0.17	0.09	0.36	0.49	

PRAVEG

પ્રવેગ કોમ્યુનિકેશન્સ ( ઇન્ડિયા) લીમીટેડ

સીન : L24231GJ1995PLC024809 રજીસ્ટર્ડ ઓફિસ : ૨૧૪, એવેના એવેન્યુ, જગુઆર સોર્ટ્સ પાઇળ, એસ.જી. હાઈવે, ગોતા, અમદાવાદ- ૩૮૨૪૮ ફોન : + ૯૧ ૭૯ ૨૭૪૯૬૭૩૭ ৷ વેબસાઇટ : www.praveg.com ઈ-મેલ : cs@praveg.com

### -વોટિંગ માટેની સૂચનાઓઃ

ત્યાદન મહત્ત્વ ભૂવાપાયા પીટર બાબતાન મોત્રવ હોટા શરી કરાયેલા લાગુ પરિપત્રો અનુસાર, કંપની તેના સભ્યોને માત્ર ઇલેક્ટ્રોનિક માધ્યમથી ("ઈ-વોટિંગ") દ્વાર લાલેલ પોરલ બેલેટ નોટિંસમાં પ્રસાલિત દરાવો પર તેમના મતના અધિકારની ઉપયોગ કરવાની સુવિધ પૂરી પાડે છે. સભ્યોની સંમતિ અથવ સંમતિનો કોટેશાવ્યલાટ કરના દૂરસ ઉન્નાદના પ્રસ્થિત હાર અર્થો. ઇનોની અર્ધીની ની સેવાઓ એજન્સી તરીકે ઈ-વોટિંગ સુવિધ પૂર્ હવા માટે સંલગ્ન કરી છે. નીચે જણાવેલ સમયગાવા દરમિયાન સભ્યો તેમના મત આપી શકે છે:

## -વોટિંગની શરૂઆતઃ સવારે ૯:૦૦ વાગ્યે (IST) શુક્રવાર, ૨૯ ઓક્ટોબર, ૨૦૨૧ -વોટિંગનો અંતઃ સાંજે ૫:૦૦ વાગ્યે (IST) શનિવાર, ૨૭ નવેમ્બર, ૨૦૨૧

પરોક્ત તારીખ અને સમયથી આગળ ઈ-વોટિંગની મંજૂરી આપવામાં આવશે નહીં અને ઈ-વોટિંગ મોડ્યુલ એનએસડીએલ દ્વારા ઉપરો. ામયગાળાની સમાપ્તિ પર તરત જ અલમ કરવામાં આવશે.

ામેટરાઇઝુડ મોડ, ફિઝિકલ મોડ અને જે સભ્યોએ તેમનું ઈમેઇલ સરનામું નોધાવ્યું નથી તેવા સભ્યો દ્વારા ઇ-વોટિંગ કરવાની રીત પોસ્ટલ બેલે. ોટિસમાં આપવામાં આવી છે. જે રીતે જે લોકો યુઝર આઈડી અને પાસવર્ડ બુલી ગયા છે, તે મેળવી / જનરેટ કરી શકે છે, તે પણ આ નોટિસમ

નોટિસમાં આવામાં આવી છે. જે રીતે જે લોકો યુઝર આઇડી અને પાસવર્ડ ભૂલા ગયા છ, ત મળવા , જ ૧૧૮૦ કરા લાક છ, તા મળવા માયવાનો આવી છે. જો આપવામાં આવી છે. જે રીતે જે લોકો યુઝર આઇડી અને પાસવર્ડ ભૂલા ગયા છે, ત મળવા , જ ૧૧૮૦ કરા લાક ગયાની અને તો તો માટે લાયક સાથવામાં આવી. અપલાભાવાથી માલિકા (ઇલેક્ટ્રીનિક સેરકોલિંગના દિસ્તામાં) માન આપવાના અપિકારો કર-ઓક તારીપ મુજક પંતાની પોક્ક પર છે કરી કેર મુક્તાને તાતિવાસી મારે સોલિંગના મામલામાં હતે . કર-ઓક તારીપ માથતા અધી તારા બની લાયકિસ્ત્રે સાથવામાં મામ મામલામાં હતે . કર-ઓક તારીપ પછી તારા બની લાયકિસ્ત્રે સાથવામાં અને લાગે તાત્રીમાં પણ તેમાં સાથવામાં અને લાગે તાત્રીમાં મામલામાં હતે . કર-ઓક તારીપ પાસ છી તારા બની લાયકિસ્ત્રે સાથવામાં અને લાયક તાત્રીમાં મામલામાં તાત્રી સાથવામાં મામલામાં તાત્રી સાથવામાં અને સાથવામાં મામલામાં તાત્રી મામલામાં સાથવામાં મામલામાં આવી કેર કરાય કરી તાત્રી મામલામાં આવી કરાય તાત્રી આ તેમાં આપણ આપાલા કરીપી મામલામાં આવી હાઇક અલ્લા તાત્રી આ પ્રતિ મામલામાં આવી કરીપી સાથવામાં આવી કરી સાથવામાં આવી કરીપી સાથવામાં આવી કરીપી કરવામાં મામલામાં આવી કરીપી ક

ે કેટલાં મેજૂર થાય તો, ઈ-મહાદાના ઊંબ્લી તારીખ એટલે કે તોવાર, રા નવેશ્વન, ૨૦૨૧ ના રોજ પાસ થયા હોવાનું માનવામાં ભે રાદ તેવામાર, ૧૦૧૧, હોવાના માત્ર કર્યા હોવાના કહેરા થશે. જે કેપનીની વેબસાઇટ www.præegcom પર પ્રદિશ્તિ થશે ને કોવાના મેળ અને સેન્ટ્રલ પિલીસ્ટરો કોવાના www.evoimpandi.com ના ડોક પ્રોસ્તાના કોવાના કોવ

બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ ના હુક્મર્થ

તારીખ : ૨૮ ઓક્ટોબર, ૨૦૨૧ સ્થળ : અમદાવાદ

**ગાંદાદા** Home Finance બાંદ (ઇસ્ટ), પુંખઈ- ૪ પ્લેટ (ઇસ્ટ), પુંખઈ- ૪

ο,	ગંગ તે હવે એકા ગાંકર મોટાસ ફારા માહિતમાર કરવામાં આવે છે.			
કમ નં.	કરજદારાસત-કરજદાર/જામીનદાર/નું નામ (લોન એકાઉન્ટ નંબર) અને સરનામું	જામીનમાં મુકેલ મિલ્કત/અમલમાં આવનારી મિલ્કતનું સરનામું	નોટીસ આપ્યાની તારીખ/ નોટીસની તારીખે બાકી ૨કમ .	એનપીએની તારીખ
٩.	સંજીવન કે કરૂણાકરણ ( કરજદાર) રશ્મી એમ સંજીવન (સહ-કરજદાર), એસઓ કરૂણાકરણ, ઇન્દ્રપ્રસ્થ સોસાયટી, જાકરાબાદ રોડ, એટ્ રાજુલા અમરેલી ૩૬પપ ૯૦/NHR,JL00001264585		२७-०८-२०२१ ३।. २,२७,२४१/-	04/08/ 2029

તારીખ: ૨૯ ઓક્ટોબર, ૨૦૨૧

#### Shantai Industries Limited

(formerly known as Wheel and Axle Textiles Limited)
Reg.Office: 820, Golden Point, Nr. Telephone Exchange, Begumpun, Falsawadi,
Ring Road, Surat - 395003. Ph: 0261 - 2455425 - 2455426
Branh/Godown :- 435, Sawlani Silk Mills Compound, G.I.D.C., Pandesara, Surat (India)
Phone: 0261 - 2891991 to 994 Fax: 0261 - 2891994
E-mail:shantalindustriestidgigmail.com \* PAN :AAAC/U2140E \* CIN :I.7411031988PLC013255
Cut of Standalone Audited Financial Results for the Quarter/Half Year ended September 30.

Particulars	Quarter Ended 30-September- 2021	Year to date figures for the period ended 30-September- 2021	Quarter Ended 30-September- 20
Total income from operations (net)	0	0	2.50
Net Profit / (Loss) from ordinary activities after tax	(3.36)	(9.48)	(32.34)
Net Profit / (Loss) for the period after tax (after Extraordinary items)	(3.36)	(9.48)	(32.34)
Equity Share Capital	150.00	150.00	150.00
Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of previous year)	599.59	599.59	599.59
Earnings Per Share (before extraordinary items) (of Rs. 10/-each) Basic : Diluted:	(0.22) (0.22)	(0.63) (0.63)	(2.16) (2.16)
Earnings Per Share (after extraordinary items) (of Rs. 10/- each) Basic : Diluted:	(0.22) (0.22)	(0.63) (0.63)	(2.16) (2.16)

he above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed with the Sto Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulation 2015. The full format of the Quarterly/Annual Financial Results are available on the Stock Exchange

Place: Surat Date: 28-10-2021

#### NANDINI TEXCOM (INDIA) LIMITED CIN: L65910GJ1994PLC021165

ntional Commerce Center, Near Kadiwala Scho

Tel:0261-4004596 Email: nandinitex.com@hotmail.com, website: nandinitex.com

STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30TH SEPTEMBER, 2021

						(Rs. in Lacs)
		QUARTER ENDE		Half Yea	Year ended	
PARTICULARS	30-09-2021	30-06-2021	30-09-2020	30-09-2021	30-09-2020	31-03-2021
	(Un-Audited)	(Un-Audited)	(Un-Audited)	(Un-Audited)	(Un-Audited)	(Audited)
PART I						
1. Net Income from Operation	1,699.44	615.19	745.50	2,314.63	745.50	3,451.32
2. Expenditure						
a. Consumption of Raw Material	-			-	-	
b. Purchase of Stock-in-Trade	1,040.00	1,101.08	892.64	2,141.08	892.64	3,663.91
c. Change in Inventories of Finished						
Goods & Work-in-progress	470.25	(536.83)	(167.54)	(66.58)	(167.54)	(367.88
d. Employees Benefits Expenses	5.65	5.46	10.82	11.11	10.83	22.36
e. Depreciation						5.79
f. Other Expenses	29.65	24.63	27.51	54.28	27.49	93.59
g. Total Expenditure	1,545.55	594.34	763.43	2,139.89	763.42	3,417.77
3. Profit from Operations before Other						
Income. Interest & Exceptional Items(1-2)	153.89	20.85	(17.93)	174.74	(17.92)	33.55
4. Other Income	(0.13)	0.15	5,90	0.03	5.93	8.17
5. Profit before Interest and Exceptional						
Items (3+4)	153.77	21.00	(12.03)	174.77	(11.99)	41.72
6. Financial Cost	13.75	15.33	23.52	29.08	23.52	41.64
7. Profit after Interest but before						
Exceptional Items (5-6)	140.02	5.67	(35.55)	145.69	(35.51)	0.08
8. Exceptional Item						
9. Profit/(Loss) from Ordinary Activities						
before Tax (7+8)	140.02	5.67	(35.55)	145.69	(35.51)	0.08
10. Taxation Expenses			,		-	
a. Current Tax						0.06
b. Deferred Tax Liability/(Assets)						0.04
c. Total Tax Expenses						0.10
11. Net Profit/(Loss) from Ordinary						
activities after tax (9-10)	140.02	5,67	(35.55)	145.69	(35.51)	(0.02
12. Extraordinary Items					- '	
13. Net Profit/(Loss) for the period (11-12)	140.02	5.67	(35.55)	145.69	(35.51)	(0.02
14. Paid up Equity Share capital	50.00	50.00	50.00	50.00	50.00	50.00
(Face value of Rs. 1/- each per share)						
15. Reserve excluding Revaluation Reserver as						
per previous Balance Sheet						
16, Earning Per Share						
Before Extraordinary Items						
a, Basic & Diluated EPS	2.80	0.11	(0.71)	2.91	(0.71)	(0.00
After Extraordinary Items			(00.2)		(007.5)	(0.00
a, Basic & Diluted EPS	2.80	0.11	(0.71)	2.91	(0.71)	(0.00

Statement of Assets and Liabilities		Unau	Audited	
Particulars		Six Months	Six Months	
raiticulais		Ended	Ended	
		30-09-21	30-09-20	31-03-21
I. EQUITY AND LIABILITIES				
(1) Shareholder's Funds				
(a) Share Capital		500.01	500.01	500.01
(b) Reserves and Surplus		354.86	173.66	209.17
(2) Non-Current Liabilities				
(a) Long-term borrowings		277.57	48.02	5.00
(b) Deferred tax liabilities (Net)				
(c) Other Long Term Liabilities				
(d) Long term provisions		-		
(3) Current Liabilities				
(a) Short-Term borrowings		710.27	384.08	932.13
(a) Trade payables		143.51	87.63	66.88
(b) Other current liabilities		76.06	54.75	3.77
(c) Short-term provisions	L			
	Total	2,062.28	1,248.15	1,716.97
II.Assets				
(1) Non-current assets				
(a) Fixed Assets		31.97	36.66	31.55
(b) Non-current investments				
(c) Deferred Tax Assets (Net)		1.20	1.24	1.20
(d) Long term loans and advances		0.87	71.83	2.02
(e) Other non-current assets		-		
(2) Current assets				
(a) Current investments				
(b) Inventories		695.62	428.70	555.88
(c) Trade receivables		716.61	445.60	629.04
(d) Cash and cash equivalents		0.21	0.87	0.20
(e) Short-term loans and advances		615.79	263.25	497.07
	Total	2,062.28	1,248.15	1,716.97

The above unaudited results have been reviewed by the Audit Committee and taken on record by the Board of Directors at their meeting held on 27th October, 2021.

2. The company is not carrying any segment in its bunness activities therefore no segment reporting has been done.

3. Previous Period's/ear's figures have been regrouped /recast wherever necessary to make them comparable with those of the current period.

Place : **Surat** Date : **27.10.2021**